

## બેંકોના કેરિટ કાર્ડ વ્યવસાય

એફએસસી. બીસી. 120/24.01.011/2000-01

12 મે, 2001

પ્રતિ,  
તમામ શિક્ષુલક કોમશીયલ બેંકો

સાહેબશ્રી,

## બેંકોના કેરિટ કાર્ડ વ્યવસાય

બેંકોના કેરિટ કાર્ડના વ્યવસાયને લગતી સિસ્ટમ અને કેરિટ કાર્ડના મુદ્દા તથા કેરિટ કાર્ડ પરની વસૂલવાની બાકી રકમ અંગે અમે એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસનો રિપોર્ટ દરેક બેંકને તેના સૂચનો માટે મોકલી આપવામાં આવ્યો છે. બેંક તરફથી આ અંગેનો પ્રતિસાદ મળ્યા બાદ નક્કી થશે કે નીચેના સૂચનો બેંકોને તેના કેરિટ કાર્ડ કઈ રીતે સુરક્ષિત અને નફાકારક બની શકે.

(i) સમયસર ભરપાઈ ન થયેલી રકમની વસૂલાત.

- કેરિટ કાર્ડનું કરજ અસુરક્ષિત શાખ પર હોય છે.

આ કરજની ચૂકવણી કાર્ડ ધારકની ચૂકવણી કરવાની ક્ષમતા પર આધારિત હોય છે. કેરિટ કાર્ડના વ્યવસાયમાં રહેલી સ્પર્ધાના કારણે એક ગ્રાહક પાસે એકથી વધુ બેંકોના કેરિટ કાર્ડ હોય છે. જે એક મહિના સુધીની કેરિટ આપે છે. જેના કારણે ગ્રાહક નિશ્ચિયત સમયમર્યાદામાં કેરિટના નાણાં પરત કરી શકતા નથી. બેંક જણો છે કે કેરિટ કાર્ડ ધારકોને તેના પોર્ટફોલિયોના આધારે કેરિટ અપાય છે. કેરિટ ખાતાનું અધ્યોગ સંચાલન કેરિટ પરનું જોખમ વધારે છે. જેના કારણે બેંકની ભરપાઈ ન થયેલી રકમ અને પાછી ન મેળવી શકાય તેવી અસ્ક્યામતો વધી જાય છે. જેથી બેંકોએ આ વ્યવસાયમાં નાણાં દૂબી જવાનો બનાવ બને તે પહેલાં યોગ્ય પગલા લેવા જોઈએ અને કેરિટ કાર્ડ પર બાકી નીકળતી રકમ ભરપાઈ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતું જોઈએ. બેંક પોતાના બોડ ઓફ ડિરેક્ટરની મંજૂરી બાદ ખાસ પ્રકારના પગલાં લેવાની યોજના બનાવી શકે છે.

- બેંકોએ કેરિટ કાર્ડની બાકી રકમ ભરપાઈ કરવા માટે રિકવરી એજન્ટ નીમતા પહેલાં ઈન્ડિયન બેંક્સ એસોસિએશનને તૈયાર કરેલા કોડ તપાસવાની સલાહ છે.

(ii) કેરિટ કાર્ડધારક અંગેની માહિતી મેળવો.

કેરિટ ઈન્ફરમેશન બ્યુરોની રચના કેરિટ જોખમ ઓછું કરવા અને નોન પરફોર્મિંગ મિલકત ઓછી કરવા માટેની યોજના પૂરી પાડવા માટે કરાઈ છે. બેંકોને સલાહ આપવામાં આવે છે કે તેના કેરિટ કાર્ડના વ્યવસાયમાં પસંદગીના ગ્રાહકો જળવવામાં મદદ મળે તે માટે એક એકથી વધુ કેરિટ ઈન્ફરમેશન બ્યુરોના સભ્ય બનતું જોઈએ. બેંકોને એવી પણ સલાહ અપાય છે કે આ વ્યવસાયમાં નાણાં ભરપાઈ ન થવાના કિસ્સા રોકવા માટે નેગેટિવ ફાઇલ પ્રોગ્રામ ચલાવવો જોઈએ.

### (iii) છેટરપિંડી પર અંકુશ

કેન્દ્રિક કાર્ડના ઉપયોગ દરમિયાન થતી છેટરપિંડીના સામાન્ય પદ્ધતિઓ નીચે મુજબ છે.

- અરજુના સમયે છેટરપિંડી
- કાર્ડના સાચા ધારકનું કાર્ડ ખોવાય કે ચોરી થાય ત્યારે
- બનાવટી અને ફેરફારવાળું કાર્ડ
- વૈપારી કાર્ડ ધારક સાથે દગ્ગાખોરી કરે ત્યારે  
બેંકોને ભલામણ કરવામાં આવે છે કે ઉપર દર્શાવાયેલ અથવા અન્ય પ્રકારે છેટરપિંડી ન થાય તે માટે આ ટરિક અંકુશ સુવિધા તૈયાર કરવી જોઈએ. છેટરપિંડી અટકાવવા માટેની કમિટી કે ટાસ્ક ફોર્સ હોય છે. જે છેટરપિંડી અટકાવવા કાયદાની મર્યાદામાં રહી મહત્વના પગલાં લે છે. બેંકોને સલાહ છે કે આવી કમિટી કે ટાસ્ક ફોર્સ સાથે જોડાણ રાખતું.

### (iv) પ્રક્રિયા

કાર્ડ સંચાલનની પ્રક્રિયાને લગતા ઉકેલ ઓફિસમાં જ પુરા પાડવા જોઈએ. આ ઉપરાંત ખાતાની ભરપાઈ, બીલિંગ, સેટલમેન્ટ અને અન્ય સેવાઓ માટે જરૂરી છે કે બેંકો પાસે પોતાની અંગત ઉકેલ પ્રક્રિયા હોવા જોઈએ. બેંકોને સલાહ છે કે આ ક્ષેત્રમાં વિકાસ માટે સારા ઓપરેટિંગ કંટ્રોલની જાતરી આપવી જોઈએ.

### (v) કેન્દ્રિક કાર્ડ પર ફી/ચાર્જિંસ

કેન્દ્રિક કાર્ડ ધારકોને સેવા આપવા બદલ બેંકો ફી વસૂલે છે. જેમાં સભ્યપદ, પ્રવેશ ફી નવીનીકરણ અને વાર્ષિક ફી, કેન્દ્રિક સુવિધા પરનો સર્વિસ ચાર્જ અને મોડી મળતી રકમ માટેના પેનલ ચાર્જનો સમાવેશ થાય છે. કાર્ડ આપતી બેંકો અને કાર્ડ ધારકો વચ્ચે પેનલ ચાર્જના મુદ્દે થાય છે તેથી બેંકોને સલાહ છે કે કેન્દ્રિક કાર્ડ આપતી વખતે ફી અને ચાર્જ અંગે કાર્ડ ધારક સાથે સ્પષ્ટતા કરી લો. કેટલીક બેંકો કાર્ડ ધારકોને રકમ મોડી જ્મા કરવા કે ભરપાઈ ન થવાના કેસમાં વ્યાજ કેટલા દરે ઉમેરાશે તે અંગેની નોટિસ મોકલાવે.

### 1. મહેરબાની કરીને રસીદ મોકલાવવી.

આપનો વિશ્વાસુ,

(કે. સીતારામ)  
મુખ્ય મણ પ્રબંધક